



## Bhakta Kavi Narsinh Mehta University

Govt. Polytechnic Campus, Bhakta Kavi Narsinh Mehta University Road,  
Khadiya, Junagadh, Gujarat (India)-362 263  
Ph.(0)0285-2681400 / Fax : 0285-2681503  
Website : <http://www.bknmu.edu.in> Email : [cebknmu@gmail.com](mailto:cebknmu@gmail.com)

પરીપત્ર:

વિષય : **F.Y./S.Y.B.Sc Nursing(Remedial) & F.Y.Post Basic B.Sc Nursing(Remedial) પરીક્ષાઓનાં**  
**પુન:મુલ્યાંકનના પરીણામ તેમજ પરીક્ષા ફોર્મ ઓનલાઈન એન્ટ્રી બાબત.**

આથી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નર્સિંગ કોલેજના આચાર્યશ્રી, કોલેજના પ્રોફેસરશ્રી તેમજ જે વિદ્યાર્થીઓને પુન:મુલ્યાંકન કરાવેલ તેઓને જણાવવામાં આવે છે કે અત્રેની યુનિવર્સિટી દ્વારા લેવાયેલ **F.Y./S.Y.B.Sc Nursing(Remedial) March – 2020 & F.Y.Post Basic B.Sc Nursing(Remedial) March – 2020** પરીક્ષાઓનાં પરીણામ સંદર્ભે જે વિદ્યાર્થીઓએ રી-એસસમેન્ટ માટે અરજી કરેલ હતી તે યુનિવર્સિટીની વેબસાઇટ [http://bknmu.icrp.in/form\\_web\\_result.aspx](http://bknmu.icrp.in/form_web_result.aspx) પર જઈને વિદ્યાર્થીઓએ પોતાના સીટ નંબર અને જન્મ તારીખ એન્ટર કરીને જોઈ શકશે.

જે વિદ્યાર્થીઓના ગુણમાં કોઈપણ જાતનો ફેરફાર થયેલ ન હોય તો તેમના ગુણ બતાવવામાં આવશે નહિ જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

સંદર્ભ : (1) Indian Nursing Council પરિપત્ર ક્રમાંક ૨૨-૧૦/૨૦૨૦ INC Date: 10/07/2020

(2) Gujarat State Council પરિપત્ર ક્રમાંક – GSCPT/Gudiness/722/2020 Date: 13/07/2020

(3) યુનિવર્સિટી એકઝીક્યુટીવકાઉન્સિલની બેઠક નં ૨૩ તા. ૦૮/૦૮/૨૦૨૦

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન નર્સિંગ કોલેજના આચાર્યશ્રી, પ્રોફેસરશ્રીઓ તેમજ સંબંધિત વિદ્યાર્થીઓને જણાવવાનું છે કે ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ તેમજ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના પરિપત્ર મુજબ અને કોવિડ – ૧૯ ની પરિસ્થિતિને ધ્યાને લઈને આગામી સમયમાં નીચે મુજબના કોર્ષનાં વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મની ઓનલાઈન એન્ટ્રીની તારીખ નીચે મુજબ રહેશે. જે નિયત સમય મર્યાદામાં કોલેજ દ્વારા તેમના લોગીન મારફત એન્ટ્રી કરવાની રહેશે જેની સર્વે સંબંધીતોએ નોંધ લેવી.

ખાસ નોંધ : -

- ઈન્ડિયન નર્સિંગના કાઉન્સિલના પરિપત્ર મુજબ **F.Y./S.Y./T.Y B.Sc Nursing** અને **F.Y.Post Basic B.Sc Nursing** ના ફક્ત પરીક્ષા ફોર્મ જ ભરવાના રહેશે તેમનું પરીણામ કાઉન્સિલના નિયમો અનુસાર કોલેજ દ્વારા યુનિવર્સિટીમાં MBP (Merit Base Progress) ના આધારે તૈયાર કરીને આપવાના રહેશે જેથી આ કોર્ષની પરીક્ષા લેવામાં આવશે નહીં.
- આ ઉપરાંત ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ના પરિપત્ર મુજબ **F.Y./S.Y/T.Y. B.P.T.** કોર્ષના પરીણામ પણ કાઉન્સિલના નિયમો અનુસાર કોલેજ દ્વારા યુનિવર્સિટીમાં MBP (Merit Base Progress) ના આધારે તૈયાર કરીને આપવાના રહેશે જેથી આ કોર્ષની પરીક્ષા લેવામાં આવશે નહીં.
- ઈન્ડિયન નર્સિંગના કાઉન્સિલના પરિપત્ર મુજબ ફાઇનલ વર્ષ એટલે **S.Y.Post Basic B.Sc Nursing** ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાની તારીખ અને ટાઈમટેબલ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જાણ કરવામાં આવશે.

ક્રમ	કોર્ષનું નામ	પરીક્ષા બાબતે	રેઝ્યુલર ફી
1	F.Y.B.SC. NURSING	(MBP RESULT)	(રેઝ્યુલર ફી ૩૫૦૦/-) તા.૨૪/૧૦/૨૦૨૦ થી તા.૦૫/૧૧/૨૦૨૦
2	S.Y.B.SC. NURSING	(MBP RESULT)	
3	T.Y.B.SC. NURSING	(MBP RESULT)	
4	F.Y. POST BASIC B.SC. NURSING	(MBP RESULT)	
5	S.Y. POST BASIC B.SC. NURSING	પરીક્ષા લેવામાં આવશે.	

**નોંધ:**

૧. દંડાત્મક ફી સાથેની છેલ્લી તારીખ બાદ દિવસ ૨(બે)માં ફી મેમો, ચેકલિસ્ટ, તેમજ પરીક્ષા ફી ભર્યાની રસીદ પરીક્ષા વિભાગમાં જમા કરાવવાની રહેશે ત્યારબાદ લેઈટ આવનાર કોલેજ પાસેથી યુનિવર્સિટી દ્વારા નિયમોનુસાર ફી લેવામાં આવશે તથા પરીક્ષા ફોર્મ ફી **“રજીસ્ટ્રાર, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ”** ના નામના ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવાની રહેશે.
૨. જે વિદ્યાર્થીઓની ટર્મ ગ્રાન્ટ ન થતી હોય તેમજ પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક થતા હોય તેવા વિદ્યાર્થીઓની એક યાદી કોલેજ લેટર પેડ પર આચાર્યશ્રીની સહી સાથે પરીક્ષા શરૂ થવાના બે સપ્તાહ પૂર્વે અચુક થી મોકલી આપવી જેથી તેમની લેવાનાર થીયરી પરીક્ષા રદબાતલ થશે. આ અંગે સઘળી જવાબદારી કોલેજની રહેશે. હાલ જે પરીક્ષાના ફોર્મ ભરવામાં આવનાર છે તે માત્ર વ્યવસ્થાના ભાગરૂપે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે.

**ખાસ નોંધ:**

૧. પ્રથમ વર્ષ પરીક્ષાના ફોર્મ સાથે વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ સિવાયના હોય તો ફાઇનલ એલીજબીલીટી સર્ટી સામેલ રાખવું.
૨. દરેક વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મમાં જે વિષય દર્શાવેલ હોય તે જ વિષયની કોલેજ દ્વારા સોફ્ટવેરમાં એન્ટ્રી કરવી.
૩. પરીક્ષાના આવેદનપત્ર કોલેજ પોતાની પાસે રેકોર્ડમાં સાચવીને રાખવા જરૂર પડવે યુનિવર્સિટી દ્વારા મંગાવવામાં આવે તો રજૂ કરવાનાં રહેશે.

  
પરીક્ષા નિયામક

ક્રમાંક/બીકેએનએમયુ/પરીક્ષા/૧૦૨૬/૨૦૨૦

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

ગવર્નમેન્ટ પોલીટેકનીક કેમ્પસ,

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ, ખડીયા, જૂનાગઢ-૩૬૨૨૬૩

તા. ૨૮/૧૦/૨૦૨૦

પ્રતિ,

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન પેરા – મેડીકલ કોલેજોના આચાર્યશ્રીઓ તરફ ....

**નકલ સાદર રવાના:-**

- (1) માન.કુલપતિશ્રી/ કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી,
- (2) આઈ.ટી. સેલ વેબસાઈટ પર પ્રસિધ્ધ થવા અર્થે.
- (3) હિસાબી શાખા